

ત્વરિત જાહેરાત માટે

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન આ ઉનાળામાં રજૂ કરશે લાઈવ મ્યુઝિક, થિએટર અને સંસ્કૃતિ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (23 જૂન 2022) – સિટી ઓફ બ્રેમ્પટન સહર્ષ રજૂ કરે છે લાઈવ મ્યુઝિક, થિએટરનું મનોરંજન અને સંસ્કૃતિ જેનો આનંદ તમામ લોકો આ ઉનાળામાં ગાર્ડન સ્ક્વેર અને દ રોઝ બ્રેમ્પટન ખાતે માણી શકશે

પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન નીચે મુજબના કાર્યક્રમો યોજી રહ્યા છે:

ટેલ્સ ઓફ એન અર્બન ઇન્ડિયન

જુન 24 અને 25, બપોરે 2 અને સાંજે 8 વાગ્યે

ટેલ્સ ઓફ એન અર્બન ઇન્ડિયનમાં સાર્થમન ડગ્લસના અદ્ભૂત પ્રવાસમાં અમારી સાથે જોડાઓ. ડેરેલ ડેનિસ દ્વારા લિખિત આ નવતર એક પાત્ર અભિનય એક આદિજાતિના વ્યક્તિની કથા છે જેનો ઉછેર ઉત્તર બ્રિટિશ કોલમ્બિયાની સાથે જ વાન્કુવર શહેરમાં પણ થયો હતો. બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બસની પૃષ્ઠભૂ સાથે બેસાડેલી આ કથામાં પ્રેક્ષકો સાર્થમનની ઉત્તરજીવિતા અને આશાઓ વચ્ચે જોવા ખાતી કથામાં રંગાઈ જશે. 40 કરતા વધુ પાત્રોને ભજવશે ત્યારે પ્રેક્ષકો સાર્થમનની આંખેથી દુનિયાને જોઈ શકશે. 500 કરતા વધુ પ્રયોગો થયા બાદ આ આંશિક રીતે આત્મકથા જેવી આ નાટિકા પ્રેક્ષકોને પોતિકાપાણું, ઓળખ અને સ્વીકૃતિ માટેની શોધ કરવા મજબૂર કરશે.

બ્રેમ્પટનનો પોતાનો શેક્સ્પિઅર શો – મછ અડૂ અબાઉટ નર્થિંગ

દર ગુરુવારે ચિંગકુઝી પાર્કમાં: જુલાઈ 28, ઓગસ્ટ 4 અને 11, સાંજે 7:30 વાગ્યે

દર શુક્રવારે માઉન્ટ પ્લેઝન્ટ સ્ક્વેરમાં: જુલાઈ 29, ઓગસ્ટ 5 અને 12, સાંજે 7:30 વાગ્યે

દર શનિવારે કેન વિલ્હાન્સ સ્ક્વેરમાં: જુલાઈ 30, ઓગસ્ટ 6 અને 13, સાંજે 7:30 વાગ્યે

લુઈ દ ગોટ પ્રોડક્શન્સ એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટનની રજૂઆત, તમામ વયના પ્રેક્ષકો આ ચાલકોની ગમતી કોમેડીનો આનંદ માણશે જ્યાં ભયંકર વસ્તુઓ થતી થતી રહી જાય છે. મેસિના શહેર હિરો અને ક્લોડિયોના લગ્નની તૈયારીમાં હતું ત્યારે પ્રિન્સના માણસો અને વિયોનાટોનો પરિવાર લાંબા સમયથી દુશ્મની નિભાવતી બિટ્રિસ અને બેનેડિક્ટને એકબીજાના પ્રેમમાં પાડવાનો પ્રયાસ કરતા રહે છે. અને આ બધા સમય દરમિયાન પ્રિન્સનો ભાઈ આના પર પાણી ફેરવી દેવાના કાવતરા કર્યા કરે છે. ત્રણ આઉટડોર સ્થળો પર ખેલ થશે જેમાં સ્થાનિક કલાકારો ભાગ લેશે, અને આ નિર્મિતીમાં બ્રેમ્પટનના પરચેન્ડીપણાના દર્શન થશે. આ ક્લાસિક પરિવાર સાથે જોવા લાયક હાસ્ય કૃતિમાં હસવા અને થોડા આંસુ વેરવા જલ્દીથી પોતાની ખુરશીઓ કે શેતરંજીઓ લઈ પહોંચી જશો.

8મી વાર્ષિક ઈસ્ટ કોસ્ટ ક્રિયન પાર્ટી

જુલાઈ 9, સાંજે 2 – 8

તમામ મેરિટાઈમરો અને મેઈનલેન્ડરોને આમંત્રણ છે – અથવા એવા બધા જેમને ફક્ત જાણવાની જાણાસા હોય – કે ઈસ્ટ કોસ્ટની સંસ્કૃતિનો ભાગ બનો ઈસ્ટ કોસ્ટ ક્રિયન પાર્ટીમાં જેના પ્રાયોજક છે ટોરોન્ટો પિઅરસન TD, નો ફિલ્સ અને ટિમ હોર્ટન્સ.

ઓલ્ડ મેન ફ્લેનિંગન્સ ઘોસ્ટ, DnA અને દ રાઉડીમેનના ખેલમાં આવો અને પ્રસ્તુતકર્તા રબેકા પેરી સાથે જોડાઓ.

સ્ટોમ્પ એન સ્ટેમ્પીડ (Stomp 'N Stampede)

ઓગસ્ટ 13, સાંજે 4 થી 8 વાગ્યે

પોતાની કાઓબોય હેટ અને બૂટ્સ લઈને અને પોતાની ડાન્સિંગ પાર્ટનરને લઈને પણ પધારી શકો છો! આ ઉનાળે, સ્ટોમ્પ એન સ્ટેમ્પીડ ગ્રામ્ય ગણાય એવી બધી જ વસ્તુઓને વધાવી લેવા ફ્રીથી ગાર્ડન સ્ક્વેરમાં આવી રહ્યા છે! DJ જોલ્ની રિવેક્સના લાઈવ સિપનિંગને માણો અને ડબલ ટ્રબલ લાઈન ડાન્સરોના ડાન્સિંગ લેસન્સ તો ચુકતા જ નહીં. કલાકારોની આખી લાઈન અપ થોડા જ સમયમાં આવી રહી છે!

સ્ટારલાઈટ સેટરડે મૂવીઝ

મિત્રને, ડેટને, શેનરંજી કે એકાદ ખુશી લઈને સ્ટારલાઈટ સેટરડે મૂવીઝમાં હાજર રહો જુલાઈ 2ના રોજ ગાર્ડન સ્ક્વેરમાં રાત્રે 9 વાગ્યે!

જુલાઈ 2 – નો ટાઈમ ટૂ ડાય

જુલાઈ 16 – દ બેટમેન

માર્કેટ સ્ક્વેર પાર્કિંગ ગેરેજ

માર્કેટ સ્ક્વેર પાર્કિંગ ગેરેજની જાળવણીના ઈરાદે સિટી ઓફ બ્રમ્પટન તેનું સમારકામ કરી રહ્યા છે જેના પરિણામે તે હંગામી ધોરણે જુન 27 થી જુલાઈ 22, 2022 સુધી બંધ રહેશે.

નીચે આપેલ નગરપાલિકાના પાર્કિંગ લોટ્સ અને ગ્રેજોમાં વ્યવસાયો અને મુલાકાતીઓને ડાઉનટાઉન બ્રમ્પટનમાં પાર્કિંગ મળવાનું ચાલુ રહેશે.

- જોલ્ન સ્ટ્રીટ પાર્કિંગ ગેરેજ, 16 જોલ્ન સ્ટ્રીટ
- સિટી હોલ પાર્કિંગ ગેરેજ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ
- વેસ્ટ ટાવર પાર્કિંગ ગેરેજ, 41 જ્યોર્જ સ્ટ્રીટ
- નેલસન સ્ક્વેર પાર્કિંગ ગેરેજ, 9 ડિપલોક લેન
- જ્યોર્જ સ્ટ્રીટ નોર્થ સર્કિસ પાર્કિંગ લોટ, 20 જ્યોર્જ સ્ટ્રીટ નોર્થ

સુવાક્યો

"આ ઉનાળામાં પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટન પાસે લાઈવ મ્યુઝિક, થિએટર અને સાંસ્કૃતિક અનુભવોના અદ્ભૂત આયોજનો છે! પછી તમારે થોડું શેક્સપિઅર જોવું હોય કે ટ્રાન્ઝિટ બસ પર કોઈ ખેલ જોવો હોય કે બ્રેમ્પટનવાસીઓ સાથે મળીને કોઈ પાર્ટીમાં આનંદ લૂટવો હોય, અહીં બધાને માટે કંઈકને કંઈક તો છે જ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન પરચરંગી છે અને આપણા સાંસ્કૃતિક અનુભવોનું આપણા ગતિશીલ શહેરને અનન્ય યોગદાન રહ્યું છે. પર્ફોર્મિંગ આર્ટ્સ બ્રેમ્પટને વિવિધ કાર્યક્રમોનું અજોડ સંકલન કર્યું છે જેમાં રહેવાસીઓ તેમજ મુલાકાતીઓ આનંદ માણી શકશે. હું તમામ લોકોને પોતપોતાના કેલેન્ડરોમાં આ તારીખો નોંધીને આખા ઉનાળામાં અમારી સાથે જોડાવા આહવાન કરું છું.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"જુલાઈ ઉત્સવોનો માસ છે ખાસ કરીને બ્રેમ્પટન માટે! ઈસ્ટ કોસ્ટ કિચન પાર્ટીમાં ન્યુક્લાઉન્ડલેન્ડ ફનમાં જોડાવા પર્ફોર્મિંગ આર્ટ્સ તમને આમંત્રણ પાઠવે છે એટલે તમારા વેસ્ટર્ન હીલ્સને ચડાવીને સ્ટોમ્પ એન સ્ટેમ્પીડ માટે તૈયાર રહો. આ બે એવા પ્રસંગો છે જે દર ઉનાળે ગાર્ડન સ્ક્વેરમાં થાય છે જે જરાયે જવા દેવા જેવા નથી. જો તમને હાસ્યરસમાં શૂંગારનો છંટકાવ ગમતો હોય તો ત્રણ પૈકી કોઈપણ એક બ્રેમ્પટન પાર્ક્સમાં શેક્સપિઅરના મધ અડૂ અબાઉટ નથિંગ જરૂર જોજો, જેની રજૂઆત બ્રેમ્પટનના કલાકારોનું એક ઉત્સાહી જૂથ કરવાનું છે. અને હા, કેરાબ્રામને ભૂલતા નહીં! બ્રેમ્પટન, આ તો જુલાઈ છે – આનંદો ભાઈ આનંદો!"

- સ્ટિવન સ્ચિપર (Steven Schipper), એગ્ઝિક્યુટિવ આર્ટિસ્ટિક ડાયરેક્ટર, પર્ફોર્મિંગ આર્ટ્સ, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca